

ત્વરિત જાહેરાત માટે

**કેનેડાના ટોચનાં મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિટી ઊભરતી
પ્રતિભાઓને શોધી રહી છે**

This is Brampton @ NXNE (આ છે બ્રેમ્પટન @ NXNE)નાં ભાગ બનો!

બ્રેમ્પટન, ઓન્ટારિયો (06 માર્ચ 2020) – બ્રેમ્પટન બોલાવી રહ્યું છે તેના તમામ ઊભરતા સંગીતકારોને!

2020 નોર્થ બાય નોર્થઈસ્ટ (NXNE) ફેસ્ટિવલ ધિસ ઈઝ બ્રેમ્પટન (*This is Brampton*) ખાતે ભાગ લેવાની અરજી કરવા સિટી સ્થાનિક પ્રતિભાઓને આમંત્રણ પાઠવે છે. NXNE ક્લબ લેન્ડ સિરિઝના ભાગરૂપે ધિસ ઈઝ બ્રેમ્પટન (*This is Brampton @ NXNE*) બ્રેમ્પટનનાં વિકાસ કરતા સંગીતના ક્ષેત્રનું ક્યુરેટ કરેલ શોકેસ છે જે શુક્રવારે, 19 જૂન 2020ના રોજ દ્રેક હોટેલ (The Drake Hotel) (1150 ક્વિન સ્ટ્રીટ વેસ્ટ, ટોરોન્ટો) ખાતે હાથ ધરાશે.

સફળ અરજીદારોને તેમના ખેલ માટે ચૂકવણી કરાશે, જેઓને આઈકોનિક ડ્રેક હોટેલ ખાતે પોતાની કલા દર્શાવવાની તક સાંપડશે, જેઓ NXNE ના માર્કેટિંગ મટિરિયલમાં જણાશે અને તેઓને NXNE ક્યુરેટર સિરિઝ + ઈન્ટરએક્ટિવ સત્રોના પાસ પ્રાપ્ત થશે.

સ્થાનિક સંગીતકારો અને દરેક જાનરના બેન્ડ્સ અહીં www.brampton.ca/NXNE પર મુલાકાત લઈને આવી બેનમૂન તક વિશે વધુ વિગતો મેળવી શકશે. કલાકારોએ પોતાના મ્યુઝિક રેકોર્ડિંગ્સ અને લાઈવ પરફોર્મન્સની લિંક પૂરી પાડવાની રહેશે. રજૂ થયેલ અરજીઓની સમીક્ષા બ્રેમ્પટનના કલાકારો અને જે તે ઉદ્યોગ વિશેષજ્ઞોની પેનલ કરશે અને પાંચ જેટલા સફળ ઉમેદવારો પર પસંદગી ઉતારશે. અરજીની અંતિમ તારીખ છે માર્ચ 31. પસંદ થયેલ કલાકારોની જાહેરાત એપ્રિલ 20મી એ કરાશે.

NXNE ક્લબ લેન્ડ સિરિઝમાં સહભાગી થવાનો સિટીનો આ ત્રીજો મોકો છે જે કેનેડાનાં ટોચના સંગીતકારો, ઉદ્યોગ અગ્રણીઓ અને સંગઠનો દ્વારા ક્યુરેટ થશે. 2019માં ધિસ ઈઝ બ્રેમ્પટન (*This is Brampton @ NXNE*) માં બ્રેમ્પટનના કલાકારો ઝેનેસોલ (Zenesoul), કે મ્યુઝિક (Kae Music), રીકો રિએફ (Reeko Rieffe), અને નોયઝ એફ્ટી (Noyz Ft) ટ્રિમેન (Tremayne) અને સ્કોટ્ટી આઈવી (Scotty IV) નું પ્રદર્શન થયું હતું. 2020માં ટોરોન્ટોના કેટલાક ટોચના સ્થળો પર 40 કરતા વધુ શો થશે.

ધિસ ઈઝ બ્રેમ્પટન (*This is Brampton @ NXNE*) વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો

www.brampton.ca/NXNE.

અવતરણો

"બ્રેમ્પટનને પોતાની કલા અને સંસ્કૃતિને ઉત્તરોત્તર વધતી જોવાનું ગૌરવ છે અને સિટી ગર્વભેર તેની પ્રતિભાના વૈવિધ્યનું સમર્થન કરે છે. આપણું એક અવસરનું શહેર છે, અને ધિસ ઈઝ બ્રેમ્પટન (This is Brampton @ NXNE) તો ખરેખર સ્થાનિક સંગીતકારો માટે કેનેડાના એક ઉચ્ચતમ સ્તરના સંગીત ઉત્સવમાં મંચ મેળવવાની અમૂલ્ય તક છે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન પાસે એક ઉન્નત સાંસ્કૃતિક ફલક છે, અને આપણા ઊભરતા અને સ્થાનિક સર્જકોને સળંગ ત્રીજે વર્ષે NXNE ખાતે પ્રદર્શિત કરવા તે આનંદની વાત છે. ધીસ ઈઝ બ્રેમ્પટને આપણા ઊભરતા કલાકારોની પ્રોફાઇલમાં ચાર ચાંદ લગાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે બ્રેમ્પટન પ્રતિભાને પોસતું ઘર છે જે નાઈટલાઈટમાં જન રેડે છે અને કન્સર્ટોને સેલ આઉટ કરે છે."

- પૉલ વિસેન્ટ, પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર) વોર્ડ 1 અને 5 તથા ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચરનાં ઉપ પ્રમુખ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca